

M.A. (PSYCHOLOGY) Semester - 3 (CBCS) Examination
Oct/Nov. -2019 – (NEW COURSE)
Behavior Modification(Elective-5)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ વર્તન ફેરફાર એટલે શું? તેના પાયાના ખ્યાલ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૧ વર્તન ફેરફારના આધારસ્તંભ સમજાવો.
- પ્રશ્ન.૨ પરંપરાગત મૂલ્યાંકન અને વાર્તાનીક મૂલ્યાંકન વચ્ચે નો તફાવત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૨ ઔપચારિક અને અનોપચારિક વર્તન વિશ્લેષણ સમજાવો.
- પ્રશ્ન.૩ ક્રમબદ્ધ અસંવેદનીકરણ વિસ્તાર પૂર્વક સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૩ મોડેલીંગ અને વાર્તાનીક પૂર્વતાલીમ ચર્ચો.
- પ્રશ્ન.૪ પ્રબલન એટલે શું? તેના પ્રકાર ચર્ચો. (૧૪)
અથવા
- પ્રશ્ન.૪ પ્રબલનના ઉપક્રમોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૫ કોઈ પણ બે ટૂંકનોંધ લખો. (૧૪)
(1) વિશ્રાંતિની પ્રયુક્તિ.
(2) વર્તનવિશ્લેષણના હેતુ.
(3) દૃઢાગ્રહ તાલીમ.
(4) સંભાવ્ય સ્થિતિઓ ના પ્રબંધ.

ENGLISH VERSION

- Que.1 What is behaviour modification? Explain it's basic concepts. (14)
OR
- Que.1 Explain the foundations of behaviour modification.
- Que.2 Explain the difference between traditional assessment and behavioural assessment. (14)
OR
- Que.2 Explain formal and informal behavioural assessment.
- Que.3 Explain systematic desensitization. (14)
OR
- Que.3 Discuss the modeling and behaviour rehearsal procedures.
- Que.4 What is reinforcement? Explain it's types. (14)
OR
- Que.4 Discuss schedules of reinforcement.
- Que.5 **Write any two short notes:** (14)
(A) Techniques of relaxation.
(B) Purpose of behavior assessment.
(C) Assertiveness training.
(D) Contingency management.